



જૂના સ્માર્ટફોન નો અનોખો ઉપયોગ કરી પર્યાવરણ પ્રત્યે નૈતિક મિત્રતા કેળવો અને રોજિંદા જીવનને જીવંત બનાવો.

જો તમે નવો સ્માર્ટફોન ખરીદવા માટે વિચારી રહ્યા હો તો, તેનો અર્થ એમ નથી કે જૂના સ્માર્ટફોન ને જૂનો કે નકામો સમજી ફેંકી દેવો, જૂના સ્માર્ટફોનનો ઉપયોગ કરી પર્યાવરણને બચાવી શકાય છે.



1. મ્યુઝિક પ્લેયર : જૂના સ્માર્ટફોન માં સંગીતની સેવા આપતી એપ્લિકેશન ને સબસ્ક્રાઇબ કરી ,બ્લ્યુટૂથ સ્પીકર અથવા ડોન્ગલ જેવા કોમેકેસ્ટ નો ઉપયોગ કરી સંગીત નો આનંદ લો.



2. ડિજિટલ ફોટોફ્રેમ : ડિજિટલ ફોટો ફ્રેમ બનાવવાની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી જૂના સ્માર્ટફોન માં તમારા મનપસંદ ફોટોની સ્લાઇડશો બનાવી, તેમજ એનિમેશન અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપી શકાય.



3. ડેસ્ક કેલેન્ડર: તમારા જૂના સ્માર્ટફોનને ટેબલ પર યોગ્ય સ્થાન આપી તેને અંગત કેલેન્ડરની જેમ વાપરી શકાય છે.



4. ઇ - બુક રીડર : શું આપને વાંચન નો શોખ છે? તો તમારા જૂના સ્માર્ટફોનમાં એમેઝોન,બર્નસ એન્ડ નોબલ અને કોબો (Amazon, Barnes & Noble and Kobo) જેવી એપ્લિકેશન દ્વારા ઇ - બુકનું વાંચન કરી શકાય છે.



5. કારમાં GPS માટે : તમારા જૂના સ્માર્ટફોનમાં હીઅર વિ ગો તથા ગૂગલ મેપ્સને (HERE WeGo or Google Maps) ઇન્સ્ટોલ કરીને મુસાફરી દરમિયાન GPSનો ઉપયોગ કરી શકાય છે.



6. દેખરેખ ઉપકરણ : વેબકેમ તથા ટાઈની કેમ મોનિટર જેવી એપ્લિકેશન દ્વારા સ્માર્ટફોનમાં રહેલા કેમેરાથી તમારી ઓફીસ અને ઘર પર તમે નજર રાખી શકો છો.

7. દીવાલ તથા એલાર્મ ઘડિયાળ:એન્ડ્રોઇડ એપ્લિકેશન માં ડિજિટલ ઘડિયાળ, જીવંત વોલ પેપર-7 (Digital Clock Live Wallpaper-7) રાખી આપની પસંદ મુજબ તારીખ અને સમય નિહાળી શકો છો.



8. એક વિન્ડો માં સમગ્ર વિશ્વ : શું તમારા ડેસ્ક ની બારી ની બહાર સારું દ્રશ્ય નથી? તો ચિંતા ના કરશો તમારા જુના સ્માર્ટફોન અથવા ટેબલેટ માં સુંદર દ્રશ્ય અર્થ કેમ વેબકેમસ એપ (Earth Cam Webcams app) દ્વારા રાખી શકો છો.

9. વાયર વગર હોટસ્પોટ : જુના સ્માર્ટફોનમાં 3g -4g પ્લાનનું સિમકાર્ડ દાખલ કરી તેને ઘરમાં હોટસ્પોટ ચાલુ કરી Wi-Fi વાપરી શકાય છે.



10. વિડિઓ ચેટિંગ માટે નો ઉપકરણ : જુના સ્માર્ટફોનમાં સ્કાય પે, હેંગ આઉટ મીટ તથા ગૂગલ ડાઉ (Skype, Hangouts Meet or Google Duo) જેવી એપ્લિકેશન રાખીને તમારા સંબંધી સાથે આભાસી ફેઈસ ટુ ફેઈસ વાતચીત કરી શકો છો.



સ્ત્રોત: www.gadgetsnow.com , www.computerworld.com , www.pcmaq.com,
<http://cercindia.org/nov-17-consumer-tips/>